

**August 13, 2022**

To,  
The Listing Department  
**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers  
Dalal Street,  
Mumbai: 400 001

Ref: **Script Code: 539384**

Sub: **Newspaper Publication: Un-Audited Standalone and Consolidated Financial Results for the First Quarter Ended on June 30, 2022.**

Dear Sir / Madam,

As required under Regulation 47 of SEBI (LODR), Regulations, 2015, please find enclosed herewith newspaper advertisement Dated 13/08/2022 as published under the Companies Act, 2013 and rules made there under in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) in connection with the un-audited Standalone and Consolidated Financial Results for the **First** quarter ended **June 30, 2022.**

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,  
For, **Krishna Capital & Securities Limited**

*Ashok Agrawal*

**Ashokkumar Agrawal**  
**(Managing Director)**  
(DIN 00944735)



**Ahmedabad: 19,000 students allotted commerce seats**  
 AHMEDABAD: After the second round of admissions, 19,877 students have been allotted seats in various Gujarat University-affiliated commerce colleges. So far, the GU admission committee has allotted seats to 35,331 students. There are around 38,350 seats in BCom, BBA, and BCA courses available in 100 GU-affiliated colleges. Sources in the GU said that the students who have been allotted seats include 12,102 general category students, 1,671 students from EWS category, 1,805 students from SC and 159 from ST categories.

**HC seeks govt affidavit on plea for SC status to all Mahars**  
 Ahmedabad: The Gujarat high court has been approached, seeking Scheduled Caste status for all members of the Mahar community and not to restrict SC status to Mahars who can establish that their forebears were residing in Gujarat before 1960. Anand Yagnik, the advocate for the petitioner, the Lord Buddha Foundation, submitted that Babasaheb Ambedkar belonged to the Mahar community, but his own community has been denied the SC status in Gujarat and the reason forwarded by the government is incorrect, improper and illegal.

**Corporation to charge Rs 70 lakh for changes in Town Planning schemes**



AHMEDABAD: If you approach the civic body asking for it to re-evaluate a preliminary or approved town planning scheme in which your plot has been included, the civic body will charge you Rs 70 lakh. This eye-watering charge came into effect on August 1 after the municipal commissioner issued a circular recently, revising the decade old fee of Rs 40 lakh. The revision comes at a time when the civic body is cash strapped.

In March 2012 the Ahmedabad Municipal Corporation (AMC) town planning department had set the 'varied fee' for a TP Scheme at Rs 40 lakh, mainly to deter objections, said AMC officials. An AMC official told TOI that whenever the AMC lays a new Town Planning scheme in a newly acquired area, procedures exist from the announcement of an intended TP scheme till the approval of the scheme. "These include meetings with landowners, where the AMC presents a draft and

takes written objections. These objections are resolved according to the rules of the GTP Act," said a senior AMC official. After the scheme is approved by the AMC, it is submitted to the state government. "The state government appoints an official town planning officer (TPO) to prepare the final TP scheme. Here too, a second round of objections is accepted by the TPO from landowners. According to the Act, the TPO can also make changes if they are valid and reasonable pertaining to reservations on plots for social infrastructure," the AMC official said.

If there are errors pertaining to taxes or other procedural errors, they are corrected at an early stage. "If there is a mistake by the AMC, the TP scheme is changed without any fee. But if the applicant applies for a change to the TP scheme for their own corrections, the fee is charged." The scenario changes in projects such as slum redevelopment where a builder is allotted work by the AMC. "When the builder demands that a road width be increased for a multi-storied slum redevelopment project, the AMC gives the builder exemption. In the last year, four or five TP schemes have been changed in cases of slum re-development and no charges were recovered from the builders."

**PRESTIGE ESTATES PROJECTS LIMITED | PERFORMANCE UPDATE-FY2022-23:Q1**

Ahmedabad, India's leading real estate developer, Prestige Estates, has announced its results for the Q1FY23. During Q1FY23, the Group registered sales of 730, 121mn, up 310%YoY, and has clocked collections of 721,464mn, up 110%YoY. The sales is attributed to 3.63mn sqft of volume with average realization of 78309/sft. Prestige Group sold a total of 2564 units in the quarter, which amounts to 28 units sold per day. Expressing his delight in this steady quarterly performance, Mr. Ifan Razack, Chairman and Managing Director, Prestige Group said, "We are delighted as we review the robust performance of Q1FY23. Prestige Group, one of the leading real estate developers in the country, has legacy of over three decades in re-stated development. (19-10)

**RAJ RAYON INDUSTRIES LIMITED**

Registered office: Survey No. 177/1/5, Village - Surang, Dist - Bhavnagar, (Badra & Nagar Haveli) (UT) - 396 230. Tel: 91-22-40349434. Fax: 91-22-40349400. email: investors@rajrayon.com, website: www.rajrayon.com | CIN No. L17120DN1999PLC003068

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022**

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		30/06/2022 Unaudited	31/03/2022 Audited	30/06/2021 Unaudited	31/03/2022 Audited
1	Total Income from Operations (Net)	28.55	-	0.04	5.54
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(345.01)	(424.08)	(872.33)	(8,035.76)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(345.01)	(1,450.72)	(872.33)	64,077.36
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	(345.01)	(1,450.72)	(872.33)	64,077.36
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and other comprehensive income (after tax)	(345.01)	(1,450.72)	(872.33)	64,077.36
6	Equity Share Capital (Face Value)	5,112.82	22.82	3,464.54	22.82
7	Other Equity	-	-	-	3,495.43
8	Earning Per Share	-	-	-	-
9	Basic (in Rs.) (Not annualised)	(0.06)	(63.56)	(0.25)	2,807.34
10	Diluted (in Rs.) (Not annualised)	(0.04)	(63.56)	(0.25)	2,807.34

Notes:  
 1. The above unaudited results have been reviewed and recommended by the Audit Committee and approved by board of directors in their meetings held on August 12, 2022. These results have been prepared in accordance with Indian Accounting Standards as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016. C. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company and they have expressed a modified conclusion.  
 2. The full format of the Quarterly Results are available on the websites of the stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and Company's website www.rajrayon.com.

**SYMBOLIC POSSESSION NOTICE**

Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-83, WIPF IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra-400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1	Bharatbhai Premabhai Jadhav & Sitabhai Bharatbhai Jadhav - 715949	Plot No. 9, Nilkanth Park, Opp. Odhav Bus Stop, Odhav, Ahmedabad, Gujarat, Ahmedabad, 382415	May 21, 2022 Rs. 3,99,550.66/- August 08, 2022	Ahmedabad
2	Rakshitkumar Rajendrakumar Shah & Shah Tinkal Rakshit - LBASD0004407762	Office No.F/225 (Unit No.225 as Per Amc Plan), 2nd Floor, Block F, Sumel-6, Plot No.113, 114, 121(P), and 123(P), T.P.S.No.14, C.S. Nos. 3140 and 3142, Dudheshwar Road, Village Daryapur-Kajipur, Tal. Asava, Dist. Ahmedabad, Gujarat 380004/August 08, 2022	May 07, 2022 Rs. 11,08,520.00/- August 08, 2022	Ahmedabad

The above-mentioned borrower(s)/ guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: August 12, 2022 Place: Ahmedabad Authorized Officer ICICI Bank Limited

**KRISHNA CAPITAL & SECURITIES LTD.**

REGD. OFFICE: 403, Mayurshikha, Nr. Parsh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 380 015. Tel: (079) 2676 8572, 2676 8573 Fax: + 91 - 79 - 2676 857, CIN: 667120GJ1994PLC023803, E-Mail: ksbspl@yahoo.in, Web Site: www.ksccl.co.in

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2022**

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2022 (Unaudited)	31/03/2022 (Audited)	30/06/2021 (Unaudited)	31/03/2022 (Audited)
<b>MONTH COVERED</b>	<b>Q</b>	<b>Q</b>	<b>Q</b>	<b>Q</b>
Total Income From Operating Income	10.93	13.75	9.88	41.37
Share of Profit / (Loss) of an Associate	1.13	8.98	8.30	16.07
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	1.13	8.98	8.30	16.07
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	0.83	7.87	8.30	15.95
Net Profit/(Loss) for the Period After Tax (after Exceptional and/or Extraordinary Items)	0.83	7.87	8.30	15.95
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	0.83	7.87	8.30	15.95
Equity Share Capital (Face Value per Share Rs. 10/- Per Share)	315.84	315.84	315.84	315.84
Basic Earnings Per Share (EPS) in Rupees after Exceptional Item	0.03	0.25	0.03	0.43
Diluted Earnings Per Share (EPS) in Rupees after Exceptional Item	0.03	0.25	0.03	0.43

**EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2022**

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2022 (Unaudited)	31/03/2022 (Audited)	30/06/2021 (Unaudited)	31/03/2022 (Audited)
<b>MONTH COVERED</b>	<b>Q</b>	<b>Q</b>	<b>Q</b>	<b>Q</b>
Total Income From Operating Income	10.93	13.75	9.88	41.37
Share of Profit / (Loss) of an Associate	0.80	0.75	8.30	0.72
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	0.25	9.20	8.30	16.79
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	0.19	6.28	8.30	14.17
Net Profit/(Loss) for the Period After Tax (after Exceptional and/or Extraordinary Items)	0.19	6.28	8.30	14.17
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	0.19	6.28	8.30	14.17
Equity Share Capital (Face Value per Share Rs. 10/- Per Share)	315.84	315.84	315.84	315.84
Basic Earnings Per Share (EPS) in Rupees after Exceptional Item	0.01	0.21	0.03	0.45
Diluted Earnings Per Share (EPS) in Rupees after Exceptional Item	0.01	0.21	0.03	0.45

NOTES:  
 1. The above is an extract of the detailed format of Standalone and Consolidated results for the Quarter ended on June 30, 2022 filed with the BSE Limited under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation, 2015. The full format of the Standalone and Consolidated results for the Quarter ended on June 30, 2022 are available on website of the BSE Limited (www.bseindia.com) and the Company's website (www.ksccl.co.in)  
 2. The above result where reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on August 12, 2022.

**PREMIER SYNTHETICS LIMITED**  
 CIN - L7100G1970PLC100829

Regd. Office : Surana House, Behind Classic Chambers, Swastik X Rd, Opp. Namanarayan Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2022 (Rs. in Lakhs)**

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		30.06.2022 Unaudited	31.03.2022 Audited	30.06.2021 Unaudited	31.03.2022 Audited
1	Total Income from Operations	1761.67	1938.04	1306.11	5908.14
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	25.07	126.67	58.50	258.63
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	25.07	126.67	58.50	258.63
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	25.07	118.43	58.50	250.39
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	25.07	118.43	58.50	250.39
6	Equity Share Capital (Face Value per Share Rs.10/- each)	459.32	459.32	459.32	459.32
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance sheet of previous year)	-	-	-	1531.74
8	Earning Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-	-	-	-
	Basic :	0.55	2.58	1.27	5.45
	Diluted :	0.55	2.58	1.27	5.45

Note:  
 The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the Quarter ended on 30th June, 2022 filed with the Stock Exchange Under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Financial Results are available on the Stock Exchange Website www.bseindia.com and on Company's website www.premiersyntheticsltd.com.  
 For, Premier Synthetics Limited  
 Sd/-  
 Gautamchand Surana  
 Managing Director

**YASH CHEMEX LIMITED**  
 FORMERLY KNOWN AS YASH CHEMEX PRIVATE LIMITED

411, 4TH FLOOR, SIGMA ICON-1, OPP. MEDILINK HOSPITAL SATELITE, AHMEDABAD-380015.  
 "TEL:- 079-40028639/26730257/26730258, Email:- yashchem@hotmail.com, "Website:- www.yashchemex.com"  
 CIN:L74110GJ2006PLC048385

**Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter Ended June 30,2022 (Rs. in lakhs)**

Particulars	Standalone Unaudited Financial Results				Consolidated Unaudited	
	Quarter Ended 30/06/2022	Quarter Ended 31/03/2022	Quarter Ended 30/06/2021	Year Ended 31/03/2022	Quarter Ended 30/06/2022	Quarter Ended 31/03/2022
1 Total Income from Operations	756.59	1,676.98	1,558.02	7,814.95	1,292.08	2,311.78
2 Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	26.89	28.44	21.64	207.56	115.44	127.97
3 Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	26.89	28.44	21.64	207.56	115.44	127.97
4 Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	20.10	21.88	16.15	145.62	94.07	91.02
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	11.13	48.16	61.71	199.62	85.10	117.30
6 Equity Share Capital of Face Value Rs.10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34
7 Earnings Per Share (of Rs. 10/- Each) (for continuing & discontinued operations)	-	-	-	-	-	-
A. Basic	0.02	0.21	0.02	1.42	0.06	0.89
B. Diluted	0.02	0.21	0.02	1.42	0.06	0.89

NOTES:  
 1. The above is an Extract of the detailed format of Unaudited Quarter Ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the Company i.e. www.yashchemex.com.  
 2. The above Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter ended on June 30,2022 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on August 12,2022. The limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditors of the company and the related report is submitted to the concerned stock exchanges.  
 3. The Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter ended on June 30,2022 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.  
 By Order of Board of Directors  
 Sd/-  
 Pritesh Shah  
 Managing Director  
 DIN : 00239665

Place : Ahmedabad  
 Date : August 12, 2022



**Kaushalya – The Skill University Launches THE SCHOOL OF DRONE**

India's first state level university recognized by DGCA for drone training



Date: 13/08/2022 | Time: 10:30 AM  
 Venue: GNLU Auditorium, Gandhinagar

- Drone pilot training system by India's first state level university recognized by DGCA for drone training
- Drone pilot training to the farmers of the state at subsidized rates
- Drone training in 50 ITIs of the state
- Plan to train 20000 drone pilots triennially
- Class 10 pass candidates can pursue training to become drone pilots
- Drone Manufacturing and Drone Related Services as well as Drone Processing and Analytics Course



